

અરબી-ગુજરાતી

કુરઆને મજીદ

પારા-૨૭

- : પ્રકાશક : -

હાજી નાજી મેમોરીયલ ટ્રસ્ટ

માળી ટેકરા, આંબાયોક, ભાવનગર

ફોનનંબર : (૦૨૭૮) ૨૫૧૦૦૫૬ / ૨૪૨૩૭૪૬

... Kitab Downloaded from ...

www.hajinaji.com

● [LIKE US ON FACEBOOK](#) ●

[HOME](#) | કુરઆને મજીદ (પારા-૨૭) -1 | [VISIT US](#)

إِنَّهُ لَقُرْآنٌ كَرِيمٌ ﴿٤٤﴾

(૭૭) બેશક આ અતિ માનવંત કુરઆન છે :

فِي كِتَابٍ مَّكْنُونٍ ﴿٤٥﴾

(૭૮) જે એક સુરક્ષિત કિતાબમાં (લખેલું) છે :

لَا يَمَسُّهَا إِلَّا الْمَطَهَّرُونَ ﴿٤٦﴾

(૭૯) પાકીઆ લોકો સિવાય તેને કોઈ અડકશે નહિ.

تَنْزِيلٌ مِّنْ رَبِّ الْعَالَمِينَ ﴿٤٧﴾

(૮૦) સઘળી દુનિયાઓના પરવરદિગાર તરફથી ઉતારવામાં આવ્યું છે.

أَفِيْهِذَا الْحَدِيثِ أَنْتُمْ مُّذْهَبُونَ ﴿٤٨﴾

(૮૧) શું તમે ત્યારે આ વાતને તુચ્છકારી કાઢો છો?

وَتَجْعَلُونَ رِزْقَكُمْ أَنْتُمْ تُكذِّبُونَ ﴿٨٢﴾

(૮૨) અને તમોએ જૂઠાણાંને જ તમારી રોઝીનું સાધન બનાવી રાખ્યું છે?

فَلَوْلَا إِذَا بَلَغَتِ الْحُلُقُومَ ﴿٨٣﴾

(૮૩) પછી જ્યારે પ્રાણ ગળા સુધી આવી પહોંચે છે:

وَأَنْتُمْ حِينِيذٍ تَنْظُرُونَ ﴿٨٤﴾

(૮૪) અને તે સમયે તમે (પડ્યા પડ્યા ટગર ટગર) જોતા જ રહો છો (ત્યારે તમારો કાબૂ કેમ ચાલતો નથી?):

وَنَحْنُ أَقْرَبُ إِلَيْهِ مِنْكُمْ وَلَكِنْ لَا تُبْصِرُونَ ﴿٨٤﴾

(૮૫) અને અમે (અથ સારવાર કરનારાઓ !) તમારા કરતાંય તે (મરનાર)ની વધુ પાસે છીએ, પણ તમને સૂઝતું જ નથી.

فَلَوْلَا إِنْ كُنْتُمْ غَيْرَ مَدِينِينَ ﴿٨٥﴾

(૮૬) પછી અગર તમે (કર્મના જવાબ માટે) કોઈના દબાએલા નથી :

تَرْجِعُونَهَا إِنْ كُنْتُمْ صَادِقِينَ ﴿٨٦﴾

(૮૭) તો અગર તમે સાચા છો તો તે (પ્રાણ)ને શા માટે પાછો ફેરવી લેતા નથી?

فَأَمَّا إِنْ كَانَ مِنَ الْمُقَرَّبِينَ ﴿٨٧﴾

(૮૮) પછી જો તેઓ અલ્લાહનું નજીકપણું મેળવેલાઓ માંના હશે:

فَرُوحٌ وَرُيْحَانٌ ۖ وَجَنَّتْ نَعِيمٌ ﴿٨٨﴾

(૮૯) તો (તેમના માટે) રાહત તથા સુગંધી ફૂલો તથા નેઅમતવાળી જન્મત છે.

وَأَمَّا إِنْ كَانَ مِنَ أَصْحَابِ الْيَمِينِ ﴿٨٩﴾

(૯૦) અને જો તે જમણી બાજુવાળાઓમાંથી હશે:

فَسَلَّمَ لَكَ مِنْ أَصْحَابِ الْيَمِينِ ﴿٩٠﴾

(૯૧) તો (અય પૂછનારા !) જમણી બાજુવાળાઓ
તરફથી તને સલામ છે.

وَأَمَّا إِنْ كَانَ مِنَ الْمُكذِبِينَ الضَّالِّينَ ﴿٩٢﴾

(૯૨) અને જો તે જૂઠલાવનારા (તથા)
ગુમરાહોમાંથી હશે:

فَنُزِّلُ مِنْ حَمِيمٍ ﴿٩٣﴾

(૯૩) તો (તેમના માટે) ઉકળતા પાણીની મહેમાન
નવાજી:

وَتَصْلِيَةٌ مِّنْ حَمِيمٍ ﴿٩٤﴾

(૯૪) અને જહન્નમમાં જવાનું છે.

إِنَّ هَذَا لَهُوَ حَقُّ الْيَقِينِ ﴿٩٥﴾

(૯૫) (આ જે કાંઈ વર્ણવવામાં આવ્યું) તે
ખાત્રીપૂર્વક સત્ય છે:

فَسَبِّحْ بِاسْمِ رَبِّكَ الْعَظِيمِ ﴿٩٦﴾

(૯૬) માટે (અય રસૂલ !) તું તારા બુઝુર્ગીવાળા
પરવરદિગારના નામના ગુણગાનગા.

હદીદ / સૂરએ الحديد

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

અલ્લાહના નામથી (શરૂ કરું છું) જે ઘણો મહેરબાન
(કૃપાળુ), બહુજ રહેમ (દયા) વાળો છે.

سَبَّحَ لِلَّهِ مَا فِي السَّمَوَاتِ وَالْأَرْضِ ۖ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ ①

(૧) આસમાનો અને જમીનમાં જે જે કાંઈ છે તે
સર્વ અલ્લાહની પવિત્રતા વર્ણવે છે, અને તે પ્રબળ
(અને) હિકમતવાળો છે.

لَهُ مُلْكُ السَّمَوَاتِ وَالْأَرْضِ ۖ يُحْيِي وَيُمِيتُ ۖ وَهُوَ عَلَىٰ كُلِّ

شَيْءٍ قَدِيرٌ ②

(૨) આસમાનો તથા જમીનની બાદશાહત તેની જ છે, તે જ જીવાડે અને તે જ મારે છે, અને તે જ દરેક વસ્તુ પર સંપૂર્ણ કાબૂ ધરાવે છે.

هُوَ الْأَوَّلُ وَالْآخِرُ وَالظَّاهِرُ وَالْبَاطِنُ ۗ وَهُوَ بِكُلِّ شَيْءٍ

عَلِيمٌ ۝

(૩) એજ પહેલો છે અને એજ છેલ્લો છે, અને એજ જાહેર તથા છુપો છે, અને એજ દરેક વસ્તુનો સંપૂર્ણ જાણકાર છે.

هُوَ الَّذِي خَلَقَ السَّمَوَاتِ وَالْأَرْضَ فِي سِتَّةِ أَيَّامٍ ثُمَّ اسْتَوَىٰ
عَلَى الْعَرْشِ ۗ يَعْلَمُ مَا يَلْبِغُ فِي الْأَرْضِ وَمَا يُخْرِجُ مِنْهَا وَمَا

يُنزِلُ مِنَ السَّمَاءِ وَمَا يَعْرُجُ فِيهَا ۖ وَهُوَ مَعَكُمْ أَيْنَ مَا
كُنْتُمْ ۗ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ ﴿٣٧﴾

(૪) તે એજ છે કે જણે આસમાનો તથા જમીનને
છ દિવસમાં સર્જ્યા, પછી અર્શ પર પોતાની સત્તા
સ્થાપી; તેને સારી રીતે જાણે છે કે જે જમીનમાં
દાખલ થાય છે અને તેને પણ કે જે તેમાંથી
નીકળે છે, અને તેને કે જે આસમાન પરથી ઉતરે
છે અને તેને પણ કે જે તેમાં ચઢી જાય છે; અને
જ્યાં પણ તમે હો છો તે તમારી સાથેજ હોય છે;
અને જે કરણી તમે કરો છો તે અલ્લાહ નિહાળે છે.

لَهُ مُلْكُ السَّمَوَاتِ وَالْأَرْضِ ۗ وَإِلَى اللَّهِ تُرْجَعُ الْأُمُورُ ﴿٥﴾

(૫) આસમાનો તથા જમીનનો (સઘળો) અધિકાર તેને જ છે, અને સઘળા મામલાઓ તેનીજ તરફ રજૂ કરવામાં આવે છે.

يُوجِبُ اللَّيْلَ فِي النَّهَارِ وَيُوجِبُ النَّهَارَ فِي اللَّيْلِ ۖ وَهُوَ عَلِيمٌ
بِذَاتِ الصُّدُورِ ⑥

(૬) તે રાત્રિને (ઘટાડી) દિવસમાં દાખલ કરી દે છે અને દિવસને (ઘટાડી) રાત્રિમાં દાખલ કરી દે છે, અને તે હૃદયો માંની વાતોથી સંપૂર્ણ વાકેફ છે.

أَمِنُوا بِاللَّهِ وَرَسُولِهِ وَأَنْفَقُوا مِمَّا جَعَلَكُمْ مُسْتَخْلَفِينَ فِيهِ ۖ
فَالَّذِينَ آمَنُوا مِنْكُمْ وَأَنْفَقُوا لَهُمْ أَجْرٌ كَبِيرٌ ⑥

(૭) (અથ લોકો !) તમે અલ્લાહ પર તથા તેના રસૂલ પર ઇમાન લાવો, અને જે જે વસ્તુઓના તમને તેણે વારસ બનાવ્યા છે તેમાંથી (તેની રાહમાં) ખર્ચ કરો; પછી તમારામાંથી જે લોકો ઇમાન લાવ્યા અને (તેની રાહમાં) ખર્ચ કર્યો તો તેમના માટે મોટો બદલો છે.

وَمَا لَكُمْ لَا تُؤْمِنُونَ بِاللَّهِ ۗ وَالرَّسُولُ يَدْعُوكُمْ لِتُؤْمِنُوا

بِرَبِّكُمْ وَقَدْ أَخَذَ مِيثَاقَكُمْ إِن كُنْتُمْ مُؤْمِنِينَ ۝

(૮) અને તમને શું થઈ ગયું છે કે તમે અલ્લાહ પર ઇમાન નથી લાવતા ? જો કે રસૂલ તમને તમારા પાલનહાર પર ઇમાન લાવવા માટે બોલાવ્યા કરે છે, અને વળી અલ્લાહ તમારી

પાસેથી (રોઝે અલસ્તમાં) વાચદો પણ કરી ચૂક્યો છે, અગર તમે તે વાતને માનતા હો તો (માનો).

هُوَ الَّذِي يُنَزِّلُ عَلَىٰ عَبْدِهِ آيَاتٍ بَيِّنَاتٍ لِّيُخْرِجَكُم مِّنَ

الظُّلُمَاتِ إِلَى النُّورِ ۗ وَإِنَّ اللَّهَ بِكُمْ لَرَءُوفٌ رَّحِيمٌ ①

(૯) તે એજ છે જે પોતાના બંદા (મોહમ્મદ સ.અ.વ.) પર રોશન નિશાનીઓ ઉતારે છે કે જેથી તમને (નાસ્તિકપણાના) અંધકારમાંથી (ઇમાનના) પ્રકાશ તરફ કાઢી લાવે; અને બેશક અલ્લાહ તમારા સંબધમાં મોટો મહેરબાન (અને) દયાવાન છે.

وَمَا لَكُمْ أَلَّا تُنْفِقُوا فِي سَبِيلِ اللَّهِ وَلِلَّهِ مِيرَاثُ السَّمَوَاتِ
 وَالْأَرْضِ ۚ لَا يَسْتَوِي مَنكُم مَّنْ أَنْفَقَ مِن قَبْلِ الْفَتْحِ
 وَقَتْلَ أَوْلِيَّكَ أَعْظَمَ دَرَجَةً مِّنَ الَّذِينَ أَنْفَقُوا مِن بَعْدِ
 وَقَتْلُوا ۚ وَكَلَّا وَعَدَّ اللَّهُ الْحُسْنَىٰ ۚ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ خَبِيرٌ ﴿١٥﴾

(૧૦) અને તમને શું થઈ ગયું છે કે તમે
 અલ્લાહની રાહમાં ખર્ચતા નથી? જોકે આસમાનો
 તથા જમીનનો વારસો અલ્લાહનો જ છે;
 તમારામાંથી જેણે (મક્કાના) વિજય પહેલાં
 (અલ્લાહની રાહમાં) ખર્ચ કર્યો તથા જેહાદ કર્યો
 (અને જેમણે તે બાદ કર્યો) તે દરજ્જામાં સમાન
 નથી; તેમનો દરજ્જો તે લોકો કરતાં ઘણો મોટો છે

કે જેમણે (મક્કાના વિજય) પછી અલ્લાહની રાહમાં ખર્ચ કર્યો તથા જેહાદ કર્યો; જોકે અલ્લાહે સારા બદલાનો વાચદો તો સઘળાઓને કર્યો છે; અને જે કાર્યો તમે કરો છો તેનાથી અલ્લાહ સારી રીતે વાકેફ છે.

مَنْ ذَا الَّذِي يُقْرِضُ اللَّهَ قَرْضًا حَسَنًا فَيُضِعَّهُ لَهُ وَلَهُ أَجْرٌ
كَرِيمٌ ۝

(૧૧) છે કોઈ જે અલ્લાહને "કર્ઝે હસના" આપે કે અલ્લાહ તેના માટે (નો બદલો) કેટલાય ગણો વધારી દે ? અને તેના માટે માનવંત બદલો (જન્નત) પણ હોય.

يَوْمَ تَرَى الْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ يَسْعَى نُورُهُمْ بَيْنَ أَيْدِيهِمْ
 وَبِأَيْمَانِهِمْ بُشْرُكُمُ الْيَوْمَ جَنَّاتٌ تَجْرِي مِنْ تَحْتِهَا الْأَنْهَارُ
 خَالِدِينَ فِيهَا ذَٰلِكَ هُوَ الْفَوْزُ الْعَظِيمُ ﴿١٣﴾

(૧૨) જે દિવસે તું મોઅમીન પુરુષો તથા મોઅમીન સ્ત્રીઓને જોશે કે તેમનું નૂર તેમની આગળ આગળ તથા તેમના જમણા હાથ (તરફ) દોડતું જતું હશે, ત્યારે તેમને કહેવામાં આવતું હશે કે આજે તમારા માટે વધામણી (શુભ સમાચાર) છે તે જન્મતોની કે જેની હેઠળ નદીઓ વહે છે, તેમાં તમારું સદાનું રહેવાનું થશે; મહાન સફળતા તો એ જ છે.

يَوْمَ يَقُولُ الْمُنْفِقُونَ وَالْمُنْفِقَاتُ لِلَّذِينَ آمَنُوا انظُرُونَا
 نَقْتَبِسْ مِنْ نُورِكُمْ ۗ قِيلَ ارْجِعُوا وَرَاءَكُمْ فَالْتَمِسُوا
 نُورًا ۗ فَضُرِبَ بَيْنَهُم بِسُورٍ لَهُ بَابٌ بَاطِنُهُ فِيهِ الرَّحْمَةُ
 وَظَاهِرُهُ مِنْ قِبَلِهِ الْعَذَابُ ﴿١٣﴾

(૧૩) જે દિવસે દાંભિક પુરુષો તથા દાંભિક સ્ત્રીઓ
 ઇમાન લાવનારાઓને કહેશે કે અમારા માટે જરા
 થોભો કે જેથી અમે પણ તમારા નૂર (ના
 પ્રકાશમાંથી લાભ) લઈ લઈએ તો (તેમને)
 કહેવામાં આવશે કે તમે પાછા ફરી જાઓ અને
 (બીજું) નૂર શોધી લો; પછી તેમની વચ્ચે એક
 દિવાલ ઉભી કરી દેવામાં આવશે જેમ એક બારણું

હશે; જેના અંદરના ભાગમાં તો રહેમત હશે અને તેના બહારના ભાગમાં અઝાબ હશે.

يُنَادُونَهُمْ أَلَمْ نَكُنْ مَعَكُمْ ط قَالُوا بَلَىٰ وَلَكِنَّكُمْ فَتَنْتُمْ

أَنفُسَكُمْ وَتَرَبَّصْتُمْ وَارْتَبْتُمْ وَغَرَّتْكُمُ الْأَمَانِيُّ حَتَّىٰ جَاءَ

أَمْرُ اللَّهِ وَغَرَّكُمْ بِاللَّهِ الْغُرُورُ ﴿١٣﴾

(૧૪) તેઓ (દાંભિકો) તેઓ (મોઅમીનો)ને પોકારીને કહેતા હશે કે શું અમે તમારી સાથે ન હતા ? તેઓ જવાબ આપશે કે હા હતા, પણ તમોએ પોતે જ પોતાને આફતમાં નાખ્યા, અને (મોઅમીનોના સંબંધમાં) બલા (ઉતરવાની) વાટ જોતા હતા, અને તમે (દીનના સંબંધમાં) શંકામાં

પડ્યા રહ્યા, અને તમને ખોટી આશાઓએ ધોકામાં રાખી મૂક્યા હતા; અહીં સુધી કે અલ્લાહનો હુકમ આવી પહોંચ્યો અને છેતરનાર (શેતાને) તમને અલ્લાહના સંબંધમાં છેતર્યા.

فَالْيَوْمَ لَا يُؤْخَذُ مِنْكُمْ فِدْيَةٌ وَلَا مِنَ الَّذِينَ كَفَرُوا ۗ
 مَأْوَكُمْ النَّارُ ۗ هِيَ مَوْلَاكُمْ ۗ وَبئسُ الْمَصِيرُ ﴿١٥﴾

(૧૫) માટે આજના દિવસે ન તમારી પાસેથી બદલા તરીકે કાંઈ સ્વીકારવામાં આવશે. અને ન તેમનાથી કે જેઓ નાસ્તિકો હતા, અને તમારું સ્થાન જહન્નમની આગ છે; અને એજ તમારો સાથી છે અને એજ ખરાબ સ્થળ છે.

أَلَمْ يَأْنِ لِلَّذِينَ آمَنُوا أَنْ تَخْشَعَ قُلُوبُهُمْ لِذِكْرِ اللَّهِ وَمَا نَزَلَ
 مِنَ الْحَقِّ ۖ وَلَا يَكُونُوا كَالَّذِينَ أُوتُوا الْكِتَابَ مِنْ قَبْلُ
 فَطَالَ عَلَيْهِمُ الْأَمَدُ فَقَسَتْ قُلُوبُهُمْ ۖ وَكَثِيرٌ مِّنْهُمْ
 فَسِقُونَ ﴿١٦﴾

(૧૬) શું તે લોકો કે જેઓ ઇમાન લાવ્યા છે તે
 સમય નથી આવ્યો કે તેમના દિલ અલ્લાહની
 યાદ માટે તથા સત્યના સંબંધમાં જે કાંઈ ઉતર્યું છે
 તેના માટે નમ્ર બની જાય ? અને તેઓ તે લોકોના
 જેવા થઈ ન જાય કે જેમને આ પહેલાં કિતાબ
 (તવરેત તથા ઇન્જીલ) આપવામાં આવી હતી,
 પણ તેમના ઉપર એક કાળ વીતી ગયો, જેથી

તેમના હૃદય કઠણ થઇ ગયા; અને તેઓ માંના ઘણાંખરા નાફરમાન છે.

إِعْلَمُوا أَنَّ اللَّهَ يُحْيِي الْأَرْضَ بَعْدَ مَوْتِهَا ۗ قَدْ بَيَّنَّا لَكُمُ
الْآيَاتِ لَعَلَّكُمْ تَعْقِلُونَ ﴿١٤﴾

(૧૭) આ જાણી લો કે બેશક અલ્લાહ જમીનને તેના મૃત્યુ બાદ સજીવન કરે છે; ખરેખર અમોએ તમારા માટે આયતો સ્પષ્ટ કરીને વર્ણવી દીધી છે કે જેથી તમે સમજો.

إِنَّ الْمُبَدِّقِينَ وَالْمُبَدِّقَاتِ وَأَقْرَضُوا اللَّهَ قَرْضًا حَسَنًا
يُضْعَفُ لَهُمْ وَلَهُمْ أَجْرٌ كَرِيمٌ ﴿١٨﴾

(૧૮) બેશક ખેરાત કરનારા પુરુષો તથા ખેરાત કરનારી સ્ત્રીઓ તથા તેઓ કે જેમણે અલ્લાહને "કર્ઠે હસના" આપ્યું તેમના માટે તેમાં અનેકગણો વધારો કરવામાં આવશે, અને તેમના માટે માનવંત બદલો પણ હશે.

وَالَّذِينَ آمَنُوا بِاللَّهِ وَرُسُلِهِ أُولَٰئِكَ هُمُ الصَّٰدِقُونَ ۖ
 وَالشُّهَدَاءُ عِنْدَ رَبِّهِمْ ۖ لَهُمْ أَجْرُهُمْ وَنُورُهُمْ ۖ وَالَّذِينَ
 كَفَرُوا وَكَذَّبُوا بِآيَاتِنَا أُولَٰئِكَ أَصْحَابُ الْجَحِيمِ ۝^{١٩}

(૧૯) અને જે લોકો અલ્લાહ પર તથા તેના રસૂલ પર ઇમાન લાવ્યા છે તેઓજ તો તેમના પરવરદિગાર પાસે સિદ્દીક (સત્યવાદી) અને શહીદ

(અલ્લાહની રાહમાં માર્યા ગયેલા)નો દરજ્જો ધરાવે છે; તેમના માટે તેમનો બદલો પણ હશે અને નૂર પણ; અને જે લોકોએ નાસ્તિકપણું કર્યું તથા અમારી આયતોને જૂઠલાવી તેઓજ જહન્નમી છે.

إِعْلَمُوا أَنَّمَا الْحَيَاةُ الدُّنْيَا لَعِبٌ وَلَهُوَ وَّزِينَةٌ وَتَفَاخُرٌ بَيْنَكُمْ وَتَكَاثُرٌ فِي الْأَمْوَالِ وَالْأَوْلَادِ ط كَمَثَلِ غَيْثٍ أَعْجَبَ الْكُفَّارَ نَبَاتُهُ ثُمَّ يَهِيجُ فَتَرَاهُ مُصْفَرًّا ثُمَّ يَكُونُ حُطَامًا ط وَفِي الْآخِرَةِ عَذَابٌ شَدِيدٌ ۝ وَمَغْفِرَةٌ مِّنَ اللَّهِ وَرِضْوَانٌ ط وَمَا الْحَيَاةُ الدُّنْيَا إِلَّا مَتَاعُ الْغُرُورِ ﴿٢٠﴾

(૨૦) (આ) સારી રીતે સમજી લો કે દુનિયાનું જીવન રમત ગમત તથા શોભા અને આપસમાં બડાઈ કરવા તથા માલ તથા ઓલાદની વૃદ્ધિની ઇચ્છા કરવા સિવાય અન્ય કાંઈજ નથી: તેનો દાખલો વરસાદના જેવો છે કે જેનાથી ઉત્પન્ન થતી વનસ્પતિ ખેડૂતોને આશ્ચર્યમાં નાખી દે છે, પછી તે કરમાઈ જાય છે, પછી તું તેને પીળી પડી ગયેલી જુએ છે, પછી તે સૂકાઈ ચૂરેચૂરા થઈ જાય છે; અને આખેરતમાં સખત અઝાબ પણ છે, તેમજ (મોઅમીનો માટે) અલ્લાહ તરફથી ક્ષમા તથા પ્રસન્નતા પણ છે; અને દુનિયાનું જીવન ધોકાના સાધન સિવાય બીજું કાંઈ જ નથી.

سَابِقُوا إِلَىٰ مَغْفِرَةٍ مِّن رَّبِّكُمْ وَجَنَّةٍ عَرْضُهَا كَعَرْضِ
 السَّمَاءِ وَالْأَرْضِ ۗ أُعِدَّتْ لِلَّذِينَ آمَنُوا بِاللَّهِ وَرُسُلِهِ ۗ ذَٰلِكَ
 فَضْلُ اللَّهِ يُؤْتِيهِ مَن يَشَاءُ ۗ وَاللَّهُ ذُو الْفَضْلِ الْعَظِيمِ ﴿٢١﴾

(૨૧) તમે તમારા પરવરદિગારની ક્ષમા તરફ
 તથા તે જન્મત તરફ દોડો કે જે જન્મતની પહોળાઇ
 આસમાન તથા જમીન (બન્ને)ની પહોળાઇની
 બરાબર છે કે જે તે લોકો માટે તૈયાર કરવામાં
 આવી છે કે જેઓ અલ્લાહ તથા તેના રસૂલો પર
 ઇમાન લાવ્યા છે; આ અલ્લાહની મહેરબાની છે, તે
 જેને યાહે છે અર્પણ કરે છે; અને અલ્લાહ મહાન
 મહેરબાન છે.

مَا أَصَابَ مِنْ مُصِيبَةٍ فِي الْأَرْضِ وَلَا فِي أَنْفُسِكُمْ إِلَّا فِي كِتَابٍ مِنْ قَبْلِ أَنْ نَبْرَأَهَا ۗ إِنَّ ذَلِكَ عَلَى اللَّهِ يَسِيرٌ ﴿٢٢﴾

(૨૨) જે કોઈ પણ આફત જમીન પર કે તમારી જાત પર પડે છે તે એ પહેલાં કે અમે તે અસ્તિત્વમાં લાવીએ એક લખાણ (લવહે મહેફૂઝ)માં લખાયેલું મોજૂદ હોય છે; બેશક એ કાર્ય અલ્લાહ માટે (ઘણુંજ) સહેલું છે :

لِكَيْلَا تَأْسَوْا عَلَىٰ مَا فَاتَكُمْ وَلَا تَفْرَحُوا بِمَا آتَاكُمْ ۗ وَاللَّهُ لَا يُحِبُّ كُلَّ مُخْتَالٍ فَخُورٍ ﴿٢٣﴾

(૨૩) આ એ માટે કે તમારા હાથમાંથી જે કંઈ જતું રહે તેના માટે અફસોસ કરો નહિ, અને તેણે તમને

જે કાંઈ આપ્યું છે તે માટે કુલાઈ જાઓ નહિ; અને અલ્લાહ દરેક મગરૂર અને ખુદપસંદને દોસ્ત રાખતો નથી:

الَّذِينَ يَبْخَلُونَ وَيَأْمُرُونَ النَّاسَ بِالْبُخْلِ ط وَمَنْ يَتَوَلَّ فَإِنَّ
اللَّهَ هُوَ الْغَنِيُّ الْحَمِيدُ ﴿٤٣﴾

(૨૪) કે જો પોતે કંજૂસાઈથી વર્તે છે, અને લોકોને પણ કંજૂસાઈથી વર્તવાની આજ્ઞા કરે છે; અને કોઈ મોઢું ફેરવશે તો અલ્લાહ ખરેજ બેપરવાહ અને વખાણને પાત્ર છે.

لَقَدْ أَرْسَلْنَا رُسُلَنَا بِالْبَيِّنَاتِ وَأَنْزَلْنَا مَعَهُمُ الْكِتَابَ
وَالْمِيزَانَ لِيَقُومَ النَّاسُ بِالْقِسْطِ ؕ وَأَنْزَلْنَا الْحَدِيدَ فِيهِ

بَأْسٍ شَدِيدٍ وَمَنَافِعُ لِلنَّاسِ وَلِيَعْلَمَ اللَّهُ مَن يَنْصُرُهُ

وَرُسُلَهُ بِالْغَيْبِ ۗ إِنَّ اللَّهَ قَوِيٌّ عَزِيزٌ ﴿٢٥﴾

(૨૫) ખરેજ અમોએ પ્રત્યક્ષ દલીલો સાથે અમારા રસૂલો મોકલ્યા હતા અને તેમની સાથે સાથે અમોએ કિતાબ તથા મીઝાન (ત્રાજવું) ઉતાર્યા કે જેથી લોકો ન્યાયસર ચાલવા લાગે, અને અમોએ લોહું ઉતારયું જેમાં (લડાઇનું) સખત બળ છે, અને લોકોના માટે લાભો પણ, અને આ હેતુથી પણ કે અલ્લાહ આ જાણી લે કે તેને જોયા વિના તેની તથા તેના રસૂલોની કોણ સહાય કરે છે; બેશક અલ્લાહ મહા બળવાન અને સમર્થ છે.

وَلَقَدْ أَرْسَلْنَا نُوحًا وَإِبْرَاهِيمَ وَجَعَلْنَا فِي ذُرِّيَّتِهِمَا النُّبُوَّةَ
وَالْكِتَابَ فَمِنْهُمْ مُهُتَدٍ ۗ وَكَثِيرٌ مِّنْهُمْ فَسِقُونَ ﴿٣٦﴾

(૨૬) અને ખરેખર અમોએ નૂહને તથા ઇબ્રાહીમને
(પયગમ્બર બનાવી) મોકલ્યા હતા, અને અમોએ
તે બન્નેની ઓલાદમાં નબુવ્વત તથા કિતાબ
ઉતારી હતી, પછી તેઓમાંથી કેટલાકોએ તો
હિદાયત મેળવી, અને તેઓ માંના ઘણાંખરા
નાફરમાન હતા.

ثُمَّ قَفَّيْنَا عَلَىٰ آثَارِهِم بِرُسُلِنَا وَقَفَّيْنَا بِعِيسَى ابْنِ مَرْيَمَ
وَآتَيْنَاهُ الْإِنجِيلَ ۖ وَجَعَلْنَا فِي قُلُوبِ الَّذِينَ اتَّبَعُوهُ رَأْفَةً
وَرَحْمَةً ۗ وَرَهْبَانِيَّةً ابْتَدَعُوهَا مَا كَتَبْنَاهَا عَلَيْهِمْ إِلَّا ابْتِغَاءً

رِضْوَانِ اللَّهِ فَمَا رَعَوْهَا حَقَّ رِعَايَتِهَا ۖ فَآتَيْنَا الَّذِينَ آمَنُوا
مِنْهُمْ أَجْرَهُمْ ۖ وَكَثِيرٌ مِنْهُمْ فَاسِقُونَ ﴿٢٤﴾

(૨૭) પછી અમોએ તેમની પાછળ (પાછળ) તેમના જ ચીલે આવનારા બીજા રસૂલો મોકલ્યા, અને તેમની પછી અમોએ મરિયમના પુત્ર ઇસાને મોકલ્યો, અને તેને અમોએ ઇજ્જલ અર્પણ કરી, અને અમોએ તે લોકોના દિલોમાં કે જેમણે તે (ઇસા)ની તાબેદારી કરી પ્રેમ તથા દયા કાયમ કરી દીધાં; અને રોહબાનીયત (સંસાર ત્યાગ) તેમણે (પોતે જ) નવીન શરૂ કર્યો, (તે) અમોએ તેમના પર વાજિબ (અનિવાર્ય) કર્યો ન હતો, પરંતુ અલ્લાહની ખુશી પ્રાપ્ત કરવા માટે (તેમણે તેમ

કર્ચું હતું); પણ તેમણે તેનું એવું પાલન ન કર્યું જેવું કે પાલન કરવું જોઈએ, પછી અમોએ તે લોકોને કે જેઓ તેમનામાંથી ઇમાન લાવ્યા હતા તેમનો બદલો આપી દીધો, અને તેઓમાંથી ઘણાંખરા આજ્ઞાનો ભંગ કરનારા રહ્યા.

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَأَمِنُوا بِرَسُولِهِ يُؤْتِكُمْ كِفْلَيْنِ
 مِنْ رَحْمَتِهِ وَيَجْعَلْ لَكُمْ نُورًا تَمْشُونَ بِهِ وَيَغْفِرْ لَكُمْ ۗ وَاللَّهُ
 غَفُورٌ رَحِيمٌ ﴿٢٨﴾

(૨૮) અય ઇમાન લાવનારાઓ ! અલ્લાહથી ડરો અને તેના રસૂલ (મોહમ્મદ સ.અ.વ.) પર ઇમાન લાવો કે જેથી તે પોતાની મહેરબાનીનો બેવડો

ભાગ તમને આપે, અને તમારા માટે એવું નૂર કાયમ કરે કે જેના પ્રતાપે તમે ચાલો, તથા તમારા ગુનાહ માફ કરી દે; અને અલ્લાહ મોટો માફ કરનાર (તથા) રહેમ કરનારો છે:

لَعَلَّ يَعْلَمَ أَهْلُ الْكِتَابِ إِلَّا يَقْدِرُونَ عَلَى شَيْءٍ مِّنْ فَضْلِ
اللَّهِ وَأَنَّ الْفَضْلَ بِيَدِ اللَّهِ يُؤْتِيهِ مَن يَشَاءُ ۗ وَاللَّهُ ذُو الْفَضْلِ
الْعَظِيمِ ﴿١٩﴾

(૨૯) (આ એ માટે કહેવામાં આવે છે) કે જેથી ક્રિતાબવાળા આ જાણી લે કે તેઓ અલ્લાહની મહેરબાનીના કોઈ ભાગ પર કાબૂ ધરાવતા નથી, અને આ કે મહેરબાની માત્ર અલ્લાહના જ હાથમાં

છે; તે જેને યાહે છે અર્પણ કરે છે; અને અલ્લાહ મહાન મહેરબાન છે.